



**YASH INNOVENTURES LIMITED**

(Formerly Known As REDEX PROTECH LIMITED)

CIN: L45100GJ1991PLC016557

**Date: 14.11.2024**

To,  
Gen. Manager (DCS)  
BSE Limited.  
P J Towers, Dalal Street,  
Fort, Mumbai-400001

**SUB: INTIMATION OF ADVERTISEMENT IN NEWSPAPER UNDER REGULATION 47 OF SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS 2015.**

**REF: COMPANY CODE BSE: 523650 M/S. YASH INNOVENTURES LIMITED (FORMERLY KNOWN AS REDEX PROTECH LIMITED)**

Dear Sir,

Please find enclosed herewith copy of **Advertisement given in newspaper of unaudited financial results for the quarter and half year ended on 30<sup>th</sup> September 2024** in compliance of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The said financial results were reviewed by Audit committee and approved by the Board of Directors at its meeting held on **Wednesday, 13<sup>th</sup> November, 2024.**

You are requested to take the same on your record.

Thanking You.

Yours Sincerely,

**FOR, YASH INNOVENTURES LIMITED  
(Formerly Known as Redex Protech Limited)**

**POOJA JAIN**

Digitally signed by  
POOJA JAIN  
Date: 2024.11.14  
10:43:37 +05'30'



**POOJA JAIN  
COMPANY SECRETARY &  
COMPLIANCE OFFICER  
Encl: As Above**

Registered Office  
Corporate House No. - 3, Parshwanath Business Park,  
Behind Prahladnagar Auda Garden,  
Anandnagar Road, Ahmedabad-380015

+91 79 2970 0120  
admin@yashglobal.co.in

www.yashinnoventures.com

## AI-Vistara merger now a reality; SIA to invest Rs 3,195 cr in merged entity

Marking a significant consolidation in the fast-growing Indian aviation space, Air India on Tuesday completed the Vistara merger to create an integrated airline, partly owned by Singapore Airlines, that will be flying over 1,20,000 passengers daily and connect more than 90 destinations.

domestic and 48 international destinations, with 312 routes and 8,300 flights per week. The collective staff strength stands at over 30,000," the release said.

flight. Starting a new chapter, the merged entity operated its first flight with the code 'AI2286' from Doha to Mumbai.

In the domestic sector, the integrated entity's first flight AI2984 took off from Mumbai to Delhi. All the four flights landed at their respective destinations early in the morning on Tuesday.

The Air India-Vistara merger also marks the second major airline industry consolidation in the country after 2006-2007. Now, Air India is the lone full service Indian carrier.

In 2006-07, Indian Airlines merged with Air India and Air Sahara merged with Jet Airways. During the same period, Air Deccan was amalgamated with Kingfisher Airlines.

Air India, Vistara, and AIX Connect together had a domestic market share of little over 29 per cent in September, as per latest official data.

Singapore Airlines (SIA) said the merger has been completed and Air India will be an associated company of the airline, adding that it will invest an additional Rs 3,194.5 crore in the enlarged entity.

The airline intends to fund the cash amount for the additional capital injection by way of SIA Group's internal cash resources. "A lower additional capital injection amount, expected at about Rs 31,945 million (equivalent to approximately USD 498 million). The expected additional capital injection amount remains unchanged to date, based on the current targeted share allotment and issuance date of November 21, 2024.

While the Vistara flight code 'UK' has faded away, the airline's flights will have the code starting with the prefix 'AI2' to help customers choose at the time of booking as Vistara was well regarded for its services whereas Air India, which is in the transformation phase, has been grappling with some service issues.

"The merger of Air India and Vistara completes the consolidation and restructuring phase of the Air India Group's post-privatisation transformation journey, and is thus a significant milestone. Over the past two years, teams across the four airlines have worked closely together and with other stakeholders to ensure that the transition of people, assets, operations and, most importantly, customers, was as seamless as possible," Air India Managing Director and Chief Executive Officer Campbell Wilson said.

The iconic 'Maharaja', once synonymous with Air India for a long time, will remain in a different form in the merged entity. Around 4.5 million Club Vistara frequent flyer accounts have been transferred to Air India's flying returns programme, which has been renamed as 'Maharaja Club'.

Amongst many other aspects, Air India said more than 4,000 vendor contracts have been consolidated and 2,70,000 customer bookings migrated.

UK 115 flight from Delhi to Singapore was the last flight of Vistara with the code 'UK' while UK986 from Mumbai to Delhi was the carrier's last domestic

The completion of the much-awaited amalgamation, which was announced in November 2022, comes within six weeks of the integration of Air India Express and AIX Connect. The two mergers have created a full service carrier and a low-cost carrier of scale for the Tata Group, which is seeking to establish a "world class global aviation company with an Indian heart".

Earlier in the day, the nearly 10-year-old Vistara -- a joint venture between Tatas and Singapore Airlines -- flew into the sunset and its last flight was from Delhi to Singapore.

As part of the merger, Singapore Airlines (SIA) will invest an additional Rs 3,194.5 crore in the enlarged entity.

The enlarged Air India will operate over 5,600 weekly flights, connecting more than 90 domestic and international destinations with a fleet of 210 aircraft, according to an Air India release.

Also, the new entity will fly over 1,20,000 passengers every day and offers an extended worldwide connectivity to over 800 destinations through more than 75 codeshare and interline partners. It is now the country's largest international carrier and the second-largest domestic carrier.

"Post-merger, Air India Group operates a combined fleet of 300 aircraft covering 55

## Zydus Lifesciences net profit up 14% on strong India, US formulations biz

Ahmedabad-based Zydus Lifesciences on Tuesday reported a 13.8 per cent year-on-year (Y-o-Y) increase in consolidated net profit for the September quarter (Q2 FY25), reaching Rs 911.2 crore, up from Rs 800.7 crore recorded in the same quarter last year.

The company's revenue from operations increased to Rs 5,237 crore in Q2 FY25, a 20 per cent Y-o-Y rise from Rs 4,368 crore reported in Q2 FY24.

On a consolidated basis, the company's earnings before interest, tax, depreciation, and amortisation (Ebitda) grew by 27.5 per cent Y-o-Y to Rs 1,461.4 crore in the September quarter, with Ebitda margins at 27.9 per cent, up from 26.2 per cent in Q2 FY24.

The growth is attributed to strong performances across domestic and international formulations, and double-digit growth in the consumer wellness business.

Commenting on the results, Sharvil Patel, managing director, Zydus Lifesciences, said that sustained growth momentum across businesses, along with enhanced profitability, drove the company's strong Q2 performance. "Execution success of our differentiated pipeline in the US and outperformance of our India geography business were particularly noteworthy," he added.

For this quarter, the India formulations business reported a 10 per cent Y-o-Y rise,

reaching Rs 1,457 crore, with 12 new products launched this quarter.

The company stated that its branded formulations business outperformed the market in both chronic and acute segments, driven by strong volume growth of core and innovative products.

Zydus also reported a 29.6 per cent Y-o-Y growth in its sales in the United States (US) formulations market, due to base business volume expansion and four new launches in Q2. This includes an exclusive licensing and supply agreement with Vivit Pharmaceuticals for two gadolinium-based Magnetic Resonance Imaging (MRI) injectable contrast agents.

The Consumer Wellness business contributed 10 per cent to consolidated revenues, growing 12 per cent Y-o-Y to Rs 487.5 crore, driven by a volume increase. The company saw double-digit growth in both personal care and food and nutrition segments, boosting overall performance.

In Q2 FY25, Zydus's international markets formulations business grew by 20 per cent Y-o-Y to Rs 538.9 crore, while its active pharmaceutical ingredients (API) business saw a 15 per cent Y-o-Y drop to Rs 119.4 crore.

"With a focus on quality excellence, we will continue to align our processes and strengthen compliance," Patel added.

## Unicommerce announces acquiring e-commerce technology platform Shipway

Unicommerce, a software development company that enables e-commerce, on Tuesday announced acquiring Shipway, another such platform, in a two-step process.

In the first tranche, Unicommerce will acquire a 42.76 per cent stake in Shipway for a cash consideration of Rs 68.4 crore. It will acquire the balance stake within a year by way of a merger or stock swap through an issue of equity shares.

Unicommerce said the acquisition will expand its product suite to include solutions for courier aggregation, shipping automation and returns reduction. It will enable Unicommerce to offer a platform that uses artificial intelligence to allow brands and retailers to target buyers with "personalised, segmented and wide-reach marketing campaigns".

The two software as a service companies are based in Gurugram.

Unicommerce's product suite provides technology solutions for e-commerce warehousing, order management, shipment tracking and order payments. Shipway's technology will allow Unicommerce to offer courier aggregation and automated shipping solutions to customers.

Kapil Makhija, managing director and chief executive officer of Unicommerce eSolutions, said: "Our collective product suite of software solutions from Unicommerce and Shipway will be transformative, offering an unparalleled, one-stop, seamless solution to simplify e-commerce for businesses in India, including and beyond our 6500 customers."

Shipway co-founders Gaurav Gupta and Vikas Garg said Unicommerce has built a "dynamic" technology ecosystem and a fast-growing business. "Together, our products will be able to comprehensively serve the growing technology needs of e-commerce businesses," they said.

Expanding its capabilities, Unicommerce will offer solutions in the pre-purchase part of the e-commerce journey before a customer orders. Shipway's "ConvertWay" solution will allow brands and retailers to deploy SMS and WhatsApp marketing tools.

As part of the acquisition, the Shipway team will continue to grow the Shipway and ConvertWay businesses.

The acquisition is expected to enable Unicommerce to provide its technology solutions to 3,000 global and Indian clients of Shipway.

## Pernod Ricard becomes largest spirit maker with Rs 26,773 cr FY24 revenue

Pernod Ricard has become the largest Indian spirit maker in India in terms of revenue, with a consolidated sales revenue of Rs 26,773.22 crore in FY24, pushing its rival Diageo-owned United Spirits to the second spot, according to a regulatory filing.

United Spirits Ltd (USL) reported Rs 26,018 crore in revenue from operations for the fiscal ended on March 31, 2024, as per the regulatory filings on stock exchanges.

Pernod Ricard India Pvt Ltd (PRI) has reported an overall 6.9 per cent increase in its revenue from operations for FY24, and its profit rose 20.9 per cent to Rs 1,620.58 crore, according to the Registrar of Companies data accessed by business intelligence platform Tofler.

The total income of PRI surged 7.09 per cent to Rs 26,936.51 crore for the financial year ended March 2024.

USL reported a total income of Rs 26,243 crore for FY24.

Pernod Ricard India, which owns popular brands like Absolute, Chivas Regal, and

Glenlivet, is a fully-owned subsidiary of Pernod Ricard South Asia, a step-down unit of the French spirits maker.

Besides, it also owns an IMFL portfolio of Royal Stag, Blenders Pride and Imperial Blue.

The total excise duty paid by Pernod Ricard India to the state governments in FY24 increased 8.35 per cent to Rs 14,208.22 crore. The company paid Rs 363.92 crore in cess and other taxes.

USL, which is owned by British multinational alcoholic beverage company Diageo plc, had reported a decline of 6.5 per cent in its revenue from operations to Rs 26,018 crore. It had reported Rs 27,816 crore as its revenue from operations in FY23.

According to industry observers, USL sold 32 brands to Inbrew Beverages in FY23 to Singapore-based Inbrew Beverages, as per its strategy to focus on premiumisation.

This has led to a decline of USL, which operates in the market, with brands like Johnnie Walker, Signature, McDowell,

Smirnoff, Black & White etc.

An e-mail sent to Pernod Ricard remained unanswered by the time of filing of the story.

Earlier this year, its India MD Jean Touboul told PTI that India is now the largest market by volume and the second largest by value globally for the French spirit maker Pernod Ricard.

The India market has now become a "growth engine" for Pernod Ricard, he added.

In FY24, PRI's total tax expenses were 22.33 per cent higher at Rs 563.42 crore against Rs 460.55 crore a year ago.

Similarly, its advertising promotional expenses were 1.2 per cent higher at Rs 845.14 crore in FY24.

Its total expenses in FY24 were Rs 24,767.1 crore, up 6.04 per cent. Pernod Ricard is investing euro 200 million to build its biggest Asian distillery in Nagpur, Maharashtra would boost its exports, especially Longitude 77, the first Indian single malt whiskey from the French spirits maker.

oncology, and infectious diseases is part of Metropolis's strategy to enhance its service offerings and improve patient outcomes.

In addition to organic growth, Metropolis is exploring inorganic growth opportunities to complement its geographic and service expansion. The company is currently in discussions with potential acquisition targets, with a view to acquiring assets that align geographically or add new testing capabilities. This includes distressed yet high-potential assets that could benefit from Metropolis's established operational strengths.

The diagnostics chain is confident that its strategic investment in lab expansion, digital capabilities, and specialty services will drive sustained growth and improve revenue margins, which are expected to stabilise and grow beyond the current 25-26 per cent range in the coming quarters.

involved.

US lenders of Byju's have reportedly sought the removal of the IRP appointed to Byju's and are also demanding that the Committee of Creditors be reconstituted. The NCLT is expected to hear arguments in this case on November 18.

"The worth of what was once India's most valued startup is now zero," Byju Raveendran, the founder of the beleaguered education technology startup Byju's, said last month as he called for rebuilding the erstwhile empire from scratch, brick by brick.

Valued at \$22 billion in 2022, Byju's has seen its fortunes dwindle due to a massive cash crunch, regulatory issues.

## Metropolis Healthcare plans to expand reach to 1,000 towns in 18 months

Metropolis Healthcare, a leading diagnostics chain in India, has unveiled plans to expand its reach to 1,000 towns from a current 700 in the next 18 months.

The firm aims to strengthen its presence in tier 2 and tier 3 cities, supported by an investment of approximately Rs 65 crore over the next two years.

New laboratories will be set up primarily in states like Uttar Pradesh, Madhya Pradesh, Assam, Andhra Pradesh, Telangana, and Punjab. Existing facilities will also be upgraded, and there will be investment in technology too.

"We aim to achieve double-digit volume growth by focusing on our B2C segment and specialty tests while expanding our network to 1,000 towns," said Surendran Chemmenkotil, CEO, Metropolis Healthcare.

"To support this expansion, we are investing in

new labs, which may initially impact margins but will drive long-term growth," he said.

The company has already grown from operations in 300 towns to over 700 within the past eight quarters.

To support this expansion, Metropolis plans to open around 10 new labs in the next six months, adding to the 75-77 labs already established over the past two and a half years. Each new lab entails an investment of Rs 40 to 50 lakh and requires about two years to achieve margin positivity, according to the company.

To further fuel growth, Metropolis is placing focus on specialty tests and bundled health packages, including wellness and illness-specific packages under its 'True Health' portfolio, which has shown a 23 per cent year-on-year growth.

This focus on high-demand diagnostic categories such as gastroenterology, neurology,

## BCCI may move NCLT to seek withdrawal of Byju's insolvency proceedings

The Board of Control for Cricket in India (BCCI) is likely to move the National Company Law Tribunal (NCLT), Bengaluru, to seek the withdrawal of its insolvency plea against ed-tech firm Byju's, according to industry sources.

The move may come after the Supreme Court last month annulled the National Company Law Appellate Tribunal (NCLAT) ruling that sanctioned a settlement of Rs 158 crore between Byju's (Think and Learn Pvt Ltd) and the BCCI on October 23.

This ruling nullifies the NCLAT's earlier decision that had halted insolvency proceedings against Byju's following its agreement with

the BCCI. The Supreme Court found that the NCLAT had not adhered to the procedural norms established in the Insolvency and Bankruptcy Code (IBC), thus wrongly approving the settlement. As a result of this judgement, the Rs 158 crore that the BCCI had deposited in an escrow account will now be redirected to an escrow account managed by the Committee of Creditors (CoC).

The court reportedly criticised the NCLAT for prematurely concluding the Corporate Insolvency Resolution Process (CIRP). The court also clarified that any application for withdrawal must be made through the Interim Resolution Professional (IRP), not directly by the parties

Yash Innoventures Limited							
(CIN: L45100GJ1991PLC016557)							
(Formerly known as Redex Protech Limited)							
Registered Office: 1 Floor, Corporate House No.3, Parshwanath Business Park, Behind Prahladnagar Garden, S G Highway, Ahmedabad-380014, Gujarat, India.							
Statement of Unaudited Financial Results for the Quarter and Half Year ended September 30, 2024 (Rupees in Lacs)							
Sr. No.	Particulars	Quarter ended 30-09-2024	Quarter ended 30-06-2024	Quarter ended 30-09-2023	Half Year ended 30-09-2024	Half Year ended 30-09-2023	Year ended 31-Mar-24
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Income	-	-	147.70	-	274.94	274.94
	(a) Revenue from Operations	-	-	147.70	-	274.94	274.94
	(b) Other Income	0.15	1.68	19.55	1.83	28.54	28.99
	Total Income	0.15	1.68	167.25	1.83	303.48	303.93
2	Expenses						
	(a) Employee benefits expense	17.59	18.09	17.99	35.68	36.42	75.03
	(b) Cost of land, plots, development rights, constructed properties & others	4.26	5.78	22.46	10.04	49.80	63.01
	(c) Change in inventory	(4.26)	(5.78)	50.60	(10.04)	100.50	87.66
	(d) Depreciation	3.51	1.95	1.03	5.46	2.05	4.13
	(e) Other expenses	19.66	5.57	3.08	25.23	10.82	36.28
	Total Expenses	40.76	25.61	95.17	66.37	199.59	266.11
3	Profit/(loss) before tax (1 - 2)	(40.61)	(23.93)	72.08	(64.54)	103.89	37.83
4	Tax Expense						
	(a) Current tax	-	-	-	-	-	-
	(b) Short/(excess) provision of earlier years	-	-	-	-	-	(16.18)
	(c) Deferred tax	(0.07)	14.72	(0.05)	14.65	(0.09)	(22.43)
	Total Tax Expense	(0.07)	14.72	(0.05)	14.65	(0.09)	(38.61)
5	Profit/(loss) for the period (3 - 4)	(40.54)	(38.65)	72.13	(79.19)	103.98	76.43
6	Other Comprehensive Income	-	-	-	-	-	-
7	Total comprehensive income/(loss) for the period (5+6)	(40.54)	(38.65)	72.13	(79.19)	103.98	76.43
8	Paid-up equity share capital (face value '10/- per share)	672.12	672.12	672.12	672.12	672.12	672.12
9	Other equity	-	-	-	648.25	754.99	727.43
10	Earnings per share (₹) (not annualised except for the year ended)						
	- Basic EPS	(0.60)	(0.57)	1.07	(1.18)	1.55	1.14
	- Diluted EPS	(0.60)	(0.57)	1.07	(1.18)	1.55	1.14
	(See accompanying notes to the Financial Results)						
Notes:							
1. The above Unaudited financial results were reviewed by the Audit Committee and have been considered and approved by the Board of Directors at their meeting held on November 13, 2024.							
2. The financial results of the company have been prepared in accordance with the companies (Indian Accounting Standards) Rules, 2015 (Indas) Prescribed Under Section 133 of the companies Act, 2013.							
3. The Company is engaged in only one Segment viz. "Construction" and as such there is no separate reportable segment as per Ind AS -108 'Operating Segments'. The Company's operation is predominantly confined to India.							
4. The figures for previous period have been regrouped / reclassified / restated wherever necessary to make them comparable with the current year's classification.							
5. The results for the quarter and half year ended September 30, 2024 are available on the BSE Limited website (URL: www.bseindia.com/corporates).							
For Yash Innoventures Limited SD/- Gnanesht Bhagat Managing Director DIN - 00115076							
Place: Ahmedabad Date: 13th November 2024							

# ધી ન્યુઝલાઇન

વર્ષ : ૩૧ અંક : ૬૪ તા.૧૪-૧૧-૨૦૨૪ પાનાં ૪ માલિક : જયની પબ્લીશર્સ તંત્રી : રણછોડ એન. શાહ સહ તંત્રી : રાધિકા ગંજવાલા

## હોસ્પિટલ અને હેલ્થકેર શેરોમાં આકર્ષણ

ભારતીય રૂપિયામાં મોટો ઘટાડો જોવાયો



અમેરિકામાં પ્રમુખની ચૂંટણીના પરિણામ પછી વિશ્વભરના શેરબજારોમાં તોતિંગ ઉછાળો જોવાયો. પરંતુ તેની સાથે સાથે ગ્લોબલ મજબૂત થતા ભારતીય રૂપિયામાં મોટો ઘટાડો જોવાયો છે અને રૂપિયામાં એક તબક્કે ૮૪.૩૭ નું લેવલ જોવાયું. અને આ પાસું અર્થતંત્રની ભારે નબળાઈ દર્શાવે છે. રૂપિયામાં આ પ્રકારની નબળાઈને કારણે સ્વાભાવિક છે કે તમામ આયાતો અને ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટોની આયાતોમાં મોટો ઉછાળો જોવાય અને સાથે સાથે મોંઘવારી પણ આગામી દિવસોમાં અંકુશ બહાર જશે અને આ બે

### ગામની ગપસપ

- અમેરિકામાં પ્રમુખની ચૂંટણીના પરિણામ પછી વિશ્વભરના શેરબજારોમાં તોતિંગ ઉછાળો જોવાયો.** પરંતુ તેની સાથે સાથે ગ્લોબલ મજબૂત થતા ભારતીય રૂપિયામાં મોટો ઘટાડો જોવાયો છે અને રૂપિયામાં એક તબક્કે ૮૪.૩૭ નું લેવલ જોવાયું. અને આ પાસું અર્થતંત્રની ભારે નબળાઈ દર્શાવે છે. રૂપિયામાં આ પ્રકારની નબળાઈને કારણે સ્વાભાવિક છે કે તમામ આયાતો અને ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટોની આયાતોમાં મોટો ઉછાળો જોવાય અને સાથે સાથે મોંઘવારી પણ આગામી દિવસોમાં અંકુશ બહાર જશે અને આ બે
- પાસા શેરબજાર માટે ઘાતક બન્યા છે.** પ્રમુખના પરિણામ પછી જે ઉછાળો જોવાયો તે ગુરુવારે અને શુક્રવારે પોવાઈ ગયો હતો અને ફરી એક વખત નિકટીના પ૦માંથી માંડ પાંચેક શેરોમાં કંઈક તેજની જગ્યા દેખાય છે. બાકીના શેરો ક્યાં તો કોન્સોલિડેશન ક્યાં તો નબળાઈના તબક્કામાં ફસાયા છે. હોસ્પિટલ અને હેલ્થકેર શેરોમાં આકર્ષણ વધતું જાય છે. અમેરિકા અને ઈંગ્લેન્ડમાં હોસ્પિટલની સુવિધા ખૂબ જ મર્યાદિત છે. ભલે તે દેશોમાં આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ હોય પરંતુ વસ્તીના પ્રમાણમાં પ્રેક્ટરો ખૂબ જ ઓછા છે અને તેથી બંને દેશોમાં મેડિકલ
- અમેરિકામાં પ્રમુખની ચૂંટણીના પરિણામ પછી વિશ્વભરના શેરબજારોમાં તોતિંગ ઉછાળો જોવાયો.** પરંતુ તેની સાથે સાથે ગ્લોબલ મજબૂત થતા ભારતીય રૂપિયામાં મોટો ઘટાડો જોવાયો છે અને રૂપિયામાં એક તબક્કે ૮૪.૩૭ નું લેવલ જોવાયું. અને આ પાસું અર્થતંત્રની ભારે નબળાઈ દર્શાવે છે. રૂપિયામાં આ પ્રકારની નબળાઈને કારણે સ્વાભાવિક છે કે તમામ આયાતો અને ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટોની આયાતોમાં મોટો ઉછાળો જોવાય અને સાથે સાથે મોંઘવારી પણ આગામી દિવસોમાં અંકુશ બહાર જશે અને આ બે
- પાસા શેરબજાર માટે ઘાતક બન્યા છે.** પ્રમુખના પરિણામ પછી જે ઉછાળો જોવાયો તે ગુરુવારે અને શુક્રવારે પોવાઈ ગયો હતો અને ફરી એક વખત નિકટીના પ૦માંથી માંડ પાંચેક શેરોમાં કંઈક તેજની જગ્યા દેખાય છે. બાકીના શેરો ક્યાં તો કોન્સોલિડેશન ક્યાં તો નબળાઈના તબક્કામાં ફસાયા છે. હોસ્પિટલ અને હેલ્થકેર શેરોમાં આકર્ષણ વધતું જાય છે. અમેરિકા અને ઈંગ્લેન્ડમાં હોસ્પિટલની સુવિધા ખૂબ જ મર્યાદિત છે. ભલે તે દેશોમાં આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ હોય પરંતુ વસ્તીના પ્રમાણમાં પ્રેક્ટરો ખૂબ જ ઓછા છે અને તેથી બંને દેશોમાં મેડિકલ

હોય છે અને ટ્રીટમેન્ટ અતિશય મોંઘી પછ છે અને આ પરિસ્થિતિમાં અનેક વિદેશી લોકોએ ભારતમાં ઉચ્ચ ક્વોલિટી પરંતુ કિકાયાતી ભાવે ટ્રીટમેન્ટ લેવાનું પસંદ કર્યું છે. અને તેને કારણે હોસ્પિટલ શેરોમાં આકર્ષણ વધ્યું છે. **ઓપોલો હોસ્પિટલ** શેર દિવાળી અગાઉ પણ સતત લેવલવતતા હતા. અત્યારે વધીને રૂ. ૭૪૨૧ ઉપર આવ્યો છે અને આવતા થોડા દિવસોમાં રૂ. ૭૫૧૫ અને તે પછી રૂ. ૭૬૧૬ અને તે પછીના થોડા દિવસોમાં રૂ. ૭૭૭૭નો ભાવ આવી જવાની ગણતરી છે અને તેથી થોડાક શેરો લઈને મૂકી શકાય.

**એચડીએફસી બેંક**નો શેર પણ મજબૂત તેજમાં દાખલ થયો છે. અત્યારે રૂ. ૧૭૫૪વાળા શેરમાં આવતા થોડા દિવસોમાં રૂ. ૧૭૭૭ તે પછી રૂ. ૧૭૭૦ અને તે પછીના થોડા દિવસોમાં રૂ. ૧૭૮૭નો ભાવ જોવા મળવાની ગણતરી છે. આઈટી શેરોમાં અત્યારે ખેલાડીઓનું આકર્ષણ વિખોના શેરમાં વધ્યું છે. રૂ. ૫૬૮વાળો શેર આવતા થોડા દિવસોમાં રૂ. ૫૭૭ અને તે પછીના થોડા દિવસોમાં રૂ. ૫૮૫ અને તે પછી ધીરે ધીરે રૂ. ૫૯૮ ઉપર પહોંચી જવાની સંભાવના મજબૂત છે અને તે રીતે થોડાક શેરો લઈને મૂકી શકાય.

**સ્ટેટ બેંક**ના પરિણામો ખૂબ જ પ્રોત્સાહક આવ્યા અને એનાલિસ્ટોની અપેક્ષા કરતા પણ નફામાં વધારે મોટો ઉછાળો જોવાયો છે. શુક્રવારે બજાર બંધ થયા પછી જાહેર થયેલા આ પરિણામોને કારણે રૂ. ૮૪૩ વાળા આ શેરમાં નવા અઠવાડિયામાં સુંદર ઉછાળા સાથે રૂ. ૮૫૭ અને તે પછી ધીરે ધીરે રૂ. ૮૭૬નો ભાવ જોવા મળે તેવી ગણતરી છે. અને તે પછીના ઉછાળે આ શેરમાં રૂ. ૮૦૬નો ભાવ પણ દેખાય છે.

આઈટી શેરોમાં **ટેક મહિન્દ્રા**ના શેરમાં આકર્ષણ વધ્યું છે. રૂ. ૧૬૮૧વાળો શેર આવતા થોડા દિવસોમાં રૂ. ૧૬૯૬ અને તે પછી રૂ. ૧૭૦૦ અને તે પછીના થોડા દિવસોમાં રૂ. ૧૭૪૭ ઉપર આવી જાય તે સંભાવના મજબૂત છે.

મધ્યપૂર્વના દેશોમાં હવે અમેરિકામાં નવા પ્રમુખ આવ્યા પછી થોડા સમયમાં જ યુદ્ધ અટકી જાય અને નવા પ્રોજેક્ટો શરૂ થાય તે આશાવાદ વધ્યો છે. **લાઈલ ઓલ્ડ ટુબો** અત્યારે મધ્યપૂર્વના દેશોમાં જંગી પ્રોજેક્ટો ધરાવે છે. રૂ. ૧૬૮૦વાળા આ શેરમાં આવતા થોડા દિવસોમાં રૂ. ૩૭૭૬ અને તે પછી રૂ. ૩૮૬૬ અને તે પછીના થોડા દિવસોમાં રૂ. ૩૭૭૭નો ભાવ આવી જવાની ગણતરી છે.

સામે પહે **ઈસ્ટર્ન બેંક**ના શેરમાં તેના બીજા ક્વાર્ટરના નબળા પરિણામો પછી ભારે વેચવાલી જોવાઈ છે. અત્યારે રૂ. ૧૦૫૪ ઉપર આવી ગયેલો શેર હવે બોટમઆઉટ થવાના તબક્કામાં આવી ગયો છે અને તેથી તેમાં થોડુંક રોકાણ કરી શકાય. ઝડપી ઉછાળા સાથે આ શેરમાં ઉપરમાં રૂ. ૧૦૬૧ અને તે પછી રૂ. ૧૦૬૭ અને તે પછીના ઉછાળે રૂ. ૧૦૮૧નો ભાવ જોવા મળવાની ગણતરી છે.

તેવી જ રીતે તાતાની **ટ્રેન્ડેમ** પણ પરિણામો સુંદર આવવા છતાં ભાવમાં ખૂબ જ ઘટી પ્રોફિટ લુકિંગ જોવાયું. અત્યારે રૂ. ૬૨૯૮ ઉપર પહોંચી ગયેલા ટ્રેન્ડેમ નવા અઠવાડિયામાં થોડુંક રોકાણ કરી દેજે અને યુટન લઈને આ શેર ઉપરમાં રૂ. ૬૪૮૪ અને તે પછી રૂ. ૬૬૭૧ અને તે પછીના ઉછાળે રૂ. ૬૮૯૮ ઉપર પહોંચી જવાની સંભાવના મજબૂત છે.

આમ ખૂબ જ ઘટી ગયેલા આ શેરમાં આવતા થોડા દિવસોમાં બાઉન્સબેક સાથે ૧૦ ટકાનું રિટર્ન છૂટી જાય તે નવાઈ નહિ લાગે અને તેથી બે કે પાંચ શેર લઈને મૂકી દેજે.

**નેએસડબલ્યુ સ્ટીલ** અત્યારે રૂ. ૮૯૬ ઉપર ચાલે છે અને આ શેરમાં પણ અપ્રેક્ટેન્ડ શરૂ થઈ ગયો છે. નાનું રોકાણ કરી શકાય. સામે પહે **વિલાયતમાં** હજી નાના ઘટાડાની જગ્યા બાકી છે. રૂ. ૧૨૮૩વાળા આ શેરમાં નવા અઠવાડિયામાં થોડા ઘટાડા સાથે રૂ. ૧૨૭૧ અને તે પછીના ઘટાડે રૂ. ૧૨૮૦નો ભાવ જોવા મળે તેવી ગણતરી છે. અને તેથી નવા અઠવાડિયાના મધ્ય ભાગ સુધીમાં બોટમઆઉટ થશે તેની રાહ જોવી જરૂરી છે.

**ટીસીએસ**માં પણ ગયા અઠવાડિયા દરમ્યાન બોટમઆઉટ થઈને ઉછાળાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ શેરમાં એક તબક્કે રૂ. ૩૮૧૩નું બોટમ બન્યા પછી અત્યારે રૂ. ૪૧૪૭નો ભાવ આવ્યો છે અને હવે આ શેરમાં ધીમો સુધારો આગળ વધે તેવી ગણતરી છે. ઉપરમાં રૂ. ૪૧૭૧ અને તે પછીના ઉછાળે રૂ. ૪૨૦૦ અને તે પછીના થોડા દિવસોમાં રૂ. ૪૫૫૦નો ભાવ જોવા મળવાની સંભાવના મજબૂત છે. સામે પહે **હીરો મોટોકોર્પ** અત્યારે મંદીમાં ફસાયેલો છે. રૂ. ૪૭૬૮વાળા આ શેરમાં નવા અઠવાડિયા દરમ્યાન રૂ. ૪૬૮૩ અને તે પછીના ઘટાડે રૂ. ૪૫૮૬નો ભાવ જોવા મળી જાય તે સંભાવના મજબૂત છે.

રિકાર્ડીંગ માર્કિંગ ઘટવાને કારણે ઓઈલ અને ગેસ સેક્ટરના શેરોમાં ભારે ઘટાડો શરૂ થયો છે અને તે પાછળ **ઓએનજીસી**ના રૂ. ૨૬૨.૫૫ વાળા શેરમાં પણ ભાવ ઘટશે તેવી ગણતરી છે. આગામી દિવસોમાં રૂ. ૨૫૮ અને તે પછીના ઘટાડે રૂ. ૨૫૬નો ભાવ જોવા મળવાની સંભાવના છે.

મોર્ગન સ્ટેનલી ઈમાર્કિંગ માર્કેટ ઈન્ફ્રેસ્ટ્રાક્ચર આઈએસબીએ પેપેક્ષિત વેઈટિંગ ન મળવાને કારણે ગયા અઠવાડિયા આ શેરમાં ભારે વેચવાલી શરૂ થઈ છે. અત્યારના રૂ. ૨૨૨૯વાળા આ શેરમાં આવતા થોડા દિવસોમાં રૂ. ૨૨૮૫ અને તે પછીના ઘટાડે રૂ. ૨૨૬૧નો ભાવ જોવા મળી જાય તેવી ગણતરી છે.

**તાતા મોટર્સ**ના નબળા પરિણામો પછી તે શેરમાં પણ વેચવાલી શરૂ થઈ છે. રૂ. ૮૦૫ ઉપર આવી ગયેલા આ શેરમાં નવા અઠવાડિયા દરમ્યાન રૂ. ૭૯૩ અને તે પછી રૂ. ૭૮૭નો ભાવ આવી જવાની સંભાવના મજબૂત છે. **નેસે ઈન્ડિયા**માં બોટમઆઉટ થવાનો સંકેત આપ્યો હતો. અત્યારે રૂ. ૨૯૮૫ ઉપર છે અને આ શેરમાં હવે ગમે ત્યારે તેજતરફી ટ્રેન્ડની સંભાવના મજબૂત છે. તે જ પ્રકારે **તાતા સ્ટીલ** પણ બોટમઆઉટ થશે અને ઝડપથી ઉચકાશે તેમ દર્શાવેલું છે. ૮૭૩ ઉપર આવી ગયેલો શેર હવે બોટમઆઉટ થવાના તબક્કામાં આવી ગયો છે અને તેમાં પણ ધીમો સુધારો આગળ વધે. ચાણક્યના દિવાળી અંક વખતે સ્પષ્ટ શબ્દોમાં દર્શાવેલું કે નવા વર્ષના પ્રારંભથી જ તેજનો પ્રારંભ થઈ જશે અને તે મુજબ સેન્સેક્સ-નિકેટી હવે ક્રેકશનના છેલ્લા તબક્કામાં આવી ગયા છે અને ગમે ત્યારે બજાર ફરી એક સંભવ મજબૂત અપ્રેક્ટેન્ડમાં દાખલ થાય તે સંભાવના મજબૂત છે. પરંતુ આ વખતના ઉછાળા વખતે અગાઉના સેક્ટરોને ભૂલીને ખેલાડીઓ કેટલાક નવા સેક્ટરમાં સક્રિય થશે તેમ સ્પષ્ટ રીતે દેખાય છે.

સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય વિચરની વાત કરીએ તો અમેરિકામાં ચૂંટણીઓ પૂરી થઈ અને પરિણામ પણ આવી ગયું અને તેથી નવા પ્રમુખ કોણ હશે અને તેમની નિતિ શું હશે તે અંગે અનિશ્ચિતતા પૂરી થઈ ગઈ છે. ગ્રેનાલ્ડ ટ્રમ્પ પૂરતી બહુમતી ચૂંટાઈ ગયા અને અત્યારે અમેરિકાના બંને ગૃહમાં તેમનો


વંદર આવી ગઈ છે. અને તેમાં પણ ટોચની બેંકોમાં તો એનપીએ અત્યારે ૦.૫૦ ટકાની નીચે પહોંચી ગઈ છે અને તથી સ્વાભાવિક છે કે આગામી સમયગાળામાં આ બેંકોની એનપીએની જોગવાઈ મોટા પાયે ઘટશે અને નફામાં સુંદર ઉછાળો હાંસલ થઈ શકશે. પરંતુ તેની સરખામણીમાં અત્યારે મોટા ભાગના સરકારી બેંક શેરો તદ્દન મફતના વેલ્યુએશન ઉપર ચાલે છે અને તેથી નવા વર્ષમાં આ સરકારી બેંકોના શેરો ઉપર કોક્સ કરવું ખૂબ જ જરૂરી છે.

**પંખાબ નેશનલ બેંક**માં નેટ એનપીએનું પ્રમાણ અત્યારે ૦.૨૭ ટકા ઉપર ચાલે છે અને સામે પહે તેની શેરટીક કમાણી છેલ્લા ૧૨ મહિનામાં ૧૩૫ ટકા વધી છે અને શેર અત્યારે કેવળ ૮.૪૫ના નીચા વેલ્યુએશન ઉપર પડી રહ્યો છે. અત્યારના રૂ. ૧૦૮ના ભાવે આ શેરમાં રીટરિંગ સાથે રૂ. ૧૪૦નો ભાવ જોવા મળે તે સંભાવના મજબૂત છે. એટલે કે લગભગ ૩૫થી ૪૦ ટકાનું રિટર્ન થયું.

તેવી જ રીતે **બેંક ઓફ બરોડા**નો શેર પણ ધીમા સુધારા સાથે રૂ. ૨૬૨ ઉપર આવ્યો છે. બેંક ઓફ બરોડામાં અત્યારે કેવળ ૬.૭૨ના પીઈરિશિયો ચાલે છે જેની સામે આ સેક્ટરનો સરેરાશ પીઈરિશિયો ૧૧.૭૨ ઉપર ચાલી રહ્યો છે અને તેથી વધારે નહિ તો નાખી દેતા આ શેરમાં ૫૦ ટકા રિટર્નની જગ્યા છે. અને આગામી દિવસોમાં રૂ. ૨૬૦-૨૬૨વાળા આ શેરમાં સુંદર ઉછાળા સાથે રૂ. ૩૦૦ અને તે પછી ધીરે ધીરે રૂ. ૩૦૮ના ભાવ જોવા મળી જાય તે સહેજ પણ નવાઈ નહિ લાગે. આ તો ૫૦ ટકા રિટર્ન મળશે તે દરિષ્ટિએ રૂ. ૩૦૮નો ભાવનો અંદાજ આપી રહ્યા છીએ.

આવો જ સુંદર ઉછાળો આગામી સમયગાળામાં **બેંક ઓફ ઈન્ડિયા**ના શેરમાં પણ દેખાય છે. વિવિધ સરકારી બેંકોમાં બેંક ઓફ ઈન્ડિયા એક એવી બેંક છે કે જેના પાનગીકરણ માટે સરકાર ઉત્સુક છે. અત્યારે રૂ. ૧૧૧ ઉપર પડી રહ્યો છે અને તેની છેલ્લા ૧૨ મહિનાની નફાશક્તિમાં ૨૮ ટકાનો ઉછાળો થયો છે. આ શેર ૭.૩૮ના પીઈરિશિયો ઉપર મળી રહ્યો છે અને રૂ. ૧૧૧ વાળા આ શેરમાં આવતા થોડા મહિનામાં રૂ. ૧૦૦નો ભાવ જોવા મળી જાય તે સંભાવના ખૂબ મજબૂત છે. અને તેથી આવતા ચારથી છ મહિનામાં આ શેર પણ મહત્વનો ભાગ ભજવશે તે ગણતરીએ થોડાક શેરો લઈને મૂકી શકાય.

**યુનિયન બેંક**ના શેરનું વિસ્તૃત એનાલિસીસ તો દિવાળી અંકમાં આપ્યું છે અને તે પણ આ સેક્ટર અંગેનું મહત્ત્વ દર્શાવે છે. મોટા ભાગની સરકારી બેંકોમાં અત્યાર સુધી જે પરિણામો આવ્યા તેમાં તેમના નફામાં સુંદર ઉછાળો જોવાયો છે અને સાથે સાથે એનપીએ લગભગ એક ટકાની



સંભાવના મજબૂત છે.

બેંક શેરોમાં આ વખતે સરકારી બેંક શેરોનું એનાલિસીસ અલગ આપ્યું છે અને તે પણ આ સેક્ટર અંગેનું મહત્ત્વ દર્શાવે છે. મોટા ભાગની સરકારી બેંકોમાં અત્યાર સુધી જે પરિણામો આવ્યા તેમાં તેમના નફામાં સુંદર ઉછાળો જોવાયો છે અને સાથે સાથે એનપીએ લગભગ એક ટકાની

### Yash Innoventures Limited

(CIN: L45100GJ1991PLC016557) (Formerly known as Redex Protech Limited)

Registered Office: 1 Floor, Corporate House No.3, Parshwanath Business Park, Behind Prahladnagar Garden, S G Highway, Ahmedabad-380014, Gujarat, India.

Statement of Unaudited Financial Results for the Quarter and Half Year ended September 30, 2024 (Rupees in Lacs)

Sr. No.	Particulars	Quarter ended 30-09-2024	Quarter ended 30-06-2024	Quarter ended 30-09-2023	Half Year ended 30-09-2024	Half Year ended 30-09-2023	Year ended 31-Mar-24
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Income						
	(a) Revenue from Operations	-	-	147.70	-	274.94	274.94
	(b) Other Income	0.15	1.68	19.55	1.83	28.54	28.99
	Total Income	0.15	1.68	167.25	1.83	303.48	303.93
2	Expenses						
	(a) Employee benefits expense	17.59	18.09	17.99	35.68	36.42	75.03
	(b) Cost of land, plots, development rights, constructed properties & others	4.26	5.78	22.46	10.04	49.80	63.01
	(c) Change in inventory	(4.26)	(5.78)	50.60	(10.04)	100.50	87.66
	(d) Depreciation	3.51	1.95	1.03	5.46	2.05	4.13
	(e) Other expenses	19.66	5.57	3.08	25.23	10.82	36.28
	Total Expenses	40.76	25.61	95.17	66.37	199.59	266.11
3	Profit/(loss) before tax (1 - 2)	(40.61)	(23.93)	72.08	(64.54)	103.89	37.83
4	Tax Expense						
	(a) Current tax	-	-	-	-	-	-
	(b) Short/(excess) provision of earlier years	-	-	-	-	-	(16.18)
	(c) Deferred tax	(0.07)	14.72	(0.05)	14.65	(0.09)	(22.43)
	Total Tax Expense	(0.07)	14.72	(0.05)	14.65	(0.09)	(38.61)
5	Profit/(loss) for the period (3 - 4)	(40.54)	(38.65)	72.13	(79.19)	103.98	76.43
6	Other Comprehensive Income	-	-	-	-	-	-
7	Total comprehensive income/(loss) for the period (5+6)	(40.54)	(38.65)	72.13	(79.19)	103.98	76.43
8	Paid-up equity share capital (face value '10/- per share)	672.12	672.12	672.12	672.12	672.12	672.12
9	Other equity	-	-	-	-	-	-
10	Earnings per share (*) (not annualised except for the year ended)						
	- Basic EPS	(0.60)	(0.57)	1.07	(1.18)	1.55	1.14
	- Diluted EPS	(0.60)	(0.57)	1.07	(1.18)	1.55	1.14

Notes:  
 1. The above Unaudited financial results were reviewed by the Audit Committee and have been considered and approved by the Board of Directors at their meeting held on November 13, 2024.  
 2. The financial results of the company have been prepared in accordance with the companies (Indian Accounting Standards) Rules, 2015 (Indas) Prescribed Under Section 133 of the companies Act, 2013.  
 3. The Company is engaged in only one Segment viz. 'Construction' and as such there is no separate reportable segment as per Ind AS -108 'Operating Segments'. The Company's operation is predominantly confined to India.  
 4. The figures for previous period have been regrouped / reclassified /restated wherever necessary to make them comparable with the current year's classification.  
 5. The results for the quarter and half year ended September 30, 2024 are available on the BSE Limited website (URL: www.bseindia.com/corporates).

For Yash Innoventures Limited SD/-  
**Ganesh Bhagat**  
 Managing Director  
 DIN - 00115076

Place: Ahmedabad  
 Date: 13th November 2024